



જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી

ક્રમાંક/જિ.ર.ગ.અ./૨૦૧૮-૧૯/રા.ક/૧૬૪૫-૧૭૦૦

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી

“ સી “ બ્લોક, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ

સેક્ટર-૧૧, ગાંધીનગર.

ફોન નં: ૦૭૯ ૨૩૨૪૦૩૨૪, ૯૨૨૮૪૧૦૧૦૧

તારીખ : ૧૯/૧૧/૨૦૧૮

Dsogandhinagarcity15@gmail.com

પ્રતિ,

જિલ્લા રમતગમત અધિકારીશ્રી, તમામ

ગુજરાત રાજ્ય.

વિષય :- ખેલમહાકુંભ-૨૦૧૮ રાજ્યકક્ષાની સ્પોર્ટ્સ ક્લાઇમ્બીંગ અં-૧૪,૧૭ અને
ઓપન ભાઈઓ / બહેનોની સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ બાબત.

શ્રીમાન,

સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે ખેલમહાકુંભ- ૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષા સ્પોર્ટ્સ ક્લાઇમ્બીંગ અંડર -૧૪,૧૭ અને ઓપન એજગ્રુપ ભાઈઓ / બહેનો સ્પર્ધાનું આયોજન તા. ૨૩/૧૧/૨૦૧૮ થી તા. ૨૭/૧૧/૨૦૧૮ દરમ્યાન આ સાથે સામેલ કાર્યક્રમ મુજબ થનાર છે. જે અંગેની આપના જિલ્લાની એન્ટ્રી અત્રેના ઈ.મેઇલ આઈ-ડી dsogandhinagarcity15@gmail.com ઉપર તા. ૨૨/૧૧/૨૦૧૮ સુધીમાં મોકલી આપવા વિનંતી. અને ભાગ લેનાર ખેલાડીઓને આ સાથે સામેલ કાર્યક્રમ મુજબ જાણ કરી સ્પર્ધામાં ભાગ લેવા મોકલવા વિનંતી.

રીપોર્ટીંગ તારીખ અં-૧૪ ભાઈઓ/બહેનો :- ૨૩/૧૧/૨૦૧૮ સાંજે ૦૬:૦૦ કલાકે

રીપોર્ટીંગ તારીખ અં-૧૭ ભાઈઓ/બહેનો :- ૨૫/૧૧/૨૦૧૮ સવારે ૦૯:૦૦ કલાકે

રીપોર્ટીંગ તારીખ ઓપન ભાઈઓ/બહેનો :- ૨૬/૧૧/૨૦૧૮ સવારે ૦૯:૦૦ કલાકે

રીપોર્ટીંગ નિવાસ સ્થળ ભાઈઓ / બહેનો : ગુજરાત પોલીસ એકેડમી,કરાઈ, નાના ચિલોડા થી ગાંધીનગર રીંગ રોડ, ગાંધીનગર

સ્પર્ધા તારીખ : ૨૩- ૧૧-૨૦૧૮ થી ૨૭/૧૧/૨૦૧૮ દરમ્યાન

સ્પર્ધા સ્થળ ભાઈઓ / બહેનો : ગુજરાત પોલીસ એકેડેમી,કરાઈ, નાના ચિલોડા થી ગાંધીનગર રીંગ રોડ, ગાંધીનગર

સ્પર્ધા ટેકનીકલ સંપર્ક નંબર : ૧) શ્રી નિરત ભટ્ટ (ક્લાઇમ્બીંગ વર્લ્ડ ચેરમેન) :- ૯૯૦૯૯ ૦૪૪૪૨

કાર્યાલય / નિવાસ સંપર્ક નંબર : ૧) શ્રી જીતેન્દ્ર પટેલ (પ્રા.યુ.વિ.અ) :- ૭૫૬૭૯ ૧૩૮૫૮

૨) શ્રી હાર્દિક રાહોડ :- ૯૮૨૪૮ ૭૬૧૪૯

નોંધ :- કરાઈ પોલીસ એકેડેમી પહોંચવા માટે નાના ચિલોડા થી ગાંધીનગર રીંગ રોડ જતા તપોવન સર્કલ ની વચ્ચે બ્રાઈટ સ્કુલ ઉતરવું ત્યાં અંદરની બાજુ આવેલ છે.

❖ સ્પર્ધા અંગે જરૂરી સૂચના :-

- (૧) દરેક ખેલાડીની ઓનલાઇન રજીસ્ટ્રેશનની પહોંચ ફરજિયાત સાથે લાવવાની રહેશે. તેમજ ઓનલાઇન આઈ.ડી. નંબર વાળા જ ખેલાડીઓને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે. તેમજ સ્પર્ધા કે સ્પર્ધા અનુસાર ગણવેશને શુઝની વ્યવસ્થા કરીને આવવાનું રહેશે.
 - (૨) ભાગ લેવા આવનાર ખેલાડીઓની K.M.KID વાળી એન્ટ્રી તથા એલીજબીલીટી ફોર્મ જે તે જિલ્લા રમતગમત અધિકારીના સહી સિક્કા કરીને સાથે લાવવાની રહેશે.
 - (૩) સ્પર્ધાને અનુરૂપ ગણવેશ પહેરવો ફરજિયાત રહેશે.
 - (૪) ભાગ લેનાર ખેલાડીઓએ ફરજિયાત પણે પોતાની શાળાનું બોનાફાઇડ પ્રમાણપત્ર / આધારકાર્ડ / જન્મ તારીખનો દાખલો / રહેઠાણ / ફોટો આઈ.ડી અને બેન્ક એકાઉન્ટની માહિતી ના જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે.
 - (૫) સ્પર્ધા નિવાસ સ્થળે શિસ્તબદ્ધ રીતે વર્તવાનું રહેશે. તેમજ સ્પર્ધા સ્થળે/ નિવાસ સ્થળે કોઈપણ પ્રકારનું નુકશાન કરવામાં આવશે તો તે નુકશાનની પુરેપુરી રકમ જે તે ખેલાડી/ મેનેજરે ભરપાઈ કરવાની રહેશે.
 - (૬) સ્પર્ધા પુર્ણ થયે ટીમોએ તાત્કાલિક પરત જવાનું રહેશે અને નિવાસ ખાલી કરવાનો રહેશે.
 - (૭) જે તારીખે જે વયગ્રુપની સ્પર્ધા હોય તેમને જ આવવાનું રહેશે. અન્યથા નિવાસ-ભોજનની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે.
 - (૮) સ્પર્ધામાં આવનાર સાંજે રીપોર્ટિંગ કરનાર તમામ ટીમો માટે બપોર બાદ સાંજથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.
 - (૧૦) ખેલાડીએ પોતાની સાથે કોઈપણ કિંમતી વસ્તુ લાવવી નહીં નહિતર જવાબદારી ખેલાડી/ મેનેજરની રહેશે. ખેલાડી સાથે આવનાર કોઈ પણ વ્યક્તિની નિવાસ કે ભોજનની વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે જે આવનાર વ્યક્તિએ જ કરવાની રહેશે.
- નોંધ :- સીધી રાજ્યકક્ષાની સ્પર્ધા હોવાથી પ્રવાસ ખર્ચના નાણાં ચુકવવામાં આવશે નહીં. ખેલાડીઓએ પોતાના ખર્ચેજ આવવા-જવાનું રહેશે. ફક્ત નિવાસ - ભોજનની વ્યવસ્થા મળશે. જેની ખાસ નોંધ લેવી.

જિલ્લા રમત ગમત અધિકારી
ગાંધીનગર

સવિનય નકલ રવાના જાણ સારૂ :-

- ૧) માન. સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
- ૨) માન. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર
- ૩) માન. ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર.
- ૪) માન. કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર
- ૫) માન. કલેક્ટરશ્રી, ગાંધીનગર
- ૬) માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર
- ૭) માન. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર
- ૮) માન. ડી.આઇ.જી.શ્રી પોલીસ કરાઇ એકેડમી, કરાઇ ટ્રેનીંગ સેન્ટર, ગાંધીનગર
- ૯) એડિશનલ ડી.જી.પી.શ્રી પોલીસ ટ્રેનીંગ, પોલીસ ભવન, ગાંધીનગર
- ૧૦) માન. નાયબ માહિતી નિયામકશ્રી, ગાંધીનગર, સ્પર્ધાની બહોળી પ્રસિધ્ધિ કરવા સારૂ.
- ૧૧) સિનિયર કોચશ્રી તમામ ગુજરાત રાજ્ય.
- ૧૨) નોડલ અધિકારીશ્રી, ખેલ મહાકુંભ ૨૦૧૮, સ્પોર્ટ્સ ક્લાઇમ્બીંગ રાજ્યકક્ષા સ્પર્ધા.
- ૧૩) પ્રમુખશ્રી / મંત્રીશ્રી ગુજરાત સ્પોર્ટ્સ ક્લાઇમ્બીંગ એસોશિયેશન.
- ૧૪) ચેરમેનશ્રી, ક્લાઇમ્બીંગ વર્લ્ડ, અમદાવાદ